

MARUTI INFRASTRUCTURE LIMITED

802, Surmount, Nr. Iscon Temple, Opp. Reliance Mart, S. G. Highway, Ahmedabad - 380 015.

Phone: 26860740 • E-mail: maruti_infra@yahoo.com

CIN No.: L65910GJ1994PLC023742

08th September, 2021

To,
BSE Limited
Listing Department
Phiroze Jeejeebhoy Tower,
Dalal Street, Mumbai – 400 001

Security Code: 531540

Dear Sir/Madam

Sub: Submission of Copies of Newspaper Advertisement of the Notice of 27th AGM:

Please find enclosed herewith copies of the newspaper advertisement published in Free Press Gujarat (English edition) and Lokmitra (Gujarati edition) on 08th September, 2021, in compliance with the provision of the Companies Act, 2013 and SEBI (LODR) Regulations 2015 in relation to the 27th Annual General Meeting of the Company.

The above information will also be available on the website of the Company at www.marutiinfra.in.

You are requested to please take the same on record.

Thanking you,

Yours faithfully,

For, Maruti Infrastructure Limited

Alfez Solanki

Company Secretary & Compliance Officer

Encl: As above

INTERACTIVE FINANCIAL SERVICES LIMITED

Reg. Off:.A-1006, Premium House, Behind Handloom House, Ashram Road Ahemedabad-380009 E-Mall:Info@finservices.com; Website:www.ifinservices.com; [el.: +9179-26581240 CINL:165910611994PLC023393

Notice of 27th nnual General Meeting, E – Voting and Book- Closure

Notice of 27th naual General Meeting, E – Voting and Book – Closure

title is hereby given that:

The 27th Annual General Meeting (AGM) of the members of Interactive Financial Services Limited (the company) will be held on Thursday 300n
White Financial Services Limited (the company) will be held on Thursday 300n
White Alley (AGM). The complaines will be present circular manbers 20/2001-41/

2020, 17/2020 issued by Ministry of Corporate Affairs (MCA) and circular number SEBILPO(ICD) (MDI/LIRIP)/2020/79 issued by the Securities and Exchange Board of India (SEBI)(Intermities collectively referred to as explained to the Company is being held through WC to transact the business as set forth in the notice of the AGM and and September, 2021.

The AGM and Annual Report 2020-2021 have been sent to all the members whose email IDs are registered with the company. Depository Participant(S). These documents are also available on the website of the AGM and Annual Report 2020-2021 have been sent to all the members whose email IDs are registered with the company. Depository Participant(S). These documents are also available on the website of the AGM and Annual Report 2020-2021 have been sent to all the members whose email IDs are registered with the company. Depository Participant(S). These documents are also available on the website of the AGM and Annual Report 2020-2021 have been sent to all the members whose email Instance of the AGM through emails has been completed on 71th September, 2021.

The cut-off date (24th September, 2021), may cast their votes electronically on the business as set forth in the Notice of AGM through the electronic voting system of NSDL (remote e-voting). Members are The Business as set forth in the Notice of AGM through remote e-voting or e-voting system at the AGM.

The cut-off date for determining the eliphility to vote by remote e-voting robe-voting system at the AGM and holds shares as on cut-off date in the AGM and holds shares as on cut-off date in the AGM.

or bye-voting system at the AGM shall be 24th september, 2021.

The Remote e-voting module will be disabled after 5:00 pm. IST on 29th September, 2021.

Sep

AZM ASIA, instructions for remote e-voting and instructions for Incase of queries relating to remote e-voting, members may refer to the frequently asked questions (FAQ's) for members and e-voting user manual for members at the downloads section NSDL website for call the toll free number: 1800 a 1990 or contact 1970 and with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Rules, 2015, the Register of Members and share transfer book of company (Listing Obligations and Disclosure Requirements) Rules, 2015, the Register of Members and share transfer book of company (September, 2021 (Both Days Inclusive) for the purpose of Annual General Meeting of the company. main closed in the same, 2021 (Both Days Inclusive) for the purpose of the same, 2021 (Both Days Inclusive) for the purpose of the company.

For, Interactive Financial Services Limited Sd/-

Mr. Udayan Mandavia Managing Director DIN:00740615



MARUTI INFRASTRUCTURE LIMITED

CIN: L65910GJ1994PLC023742

Regd. Office: 802, Surmount Building, Opp. Iscon Mega Mall, S. G. Highway, Ahmedabad, Gujarat-380015, India. Ph.: 079-26860740, E-mail:maruti_infra@yahoo.com, Website: www.marutiinfra.in

NOTICE OF 27TH ANNUAL GENERAL MEETING
Notice is hereby given that the 27th Annual General Meeting ("AGM") of the
members of the Company will be held through Video Conferencing or Other
Audio Visual Menas ("VC)QAM") on Thursday, 30th September, 2021 at
11:45 a.m. in compliance with the applicable provisions of the Companies
2021 at 12:50 a.m. in compliance with the applicable provisions of the Companies
2021 for any of the McA Circular no. 14/2020 dated that April, 2020, Circular no.
17/2020 dated 13th April, 2020, Circular no. 20/2020 dated 13th May, 2020
SEEL Circular No. 102/2021 dated 13th January, 2022 (MCA Circulars) and
SEEL Circular No. 102/2021 dated 13th January, 2022 (MCA Circulars) and
SEEL Circular No. 102/2021 dated 13th January, 2022 (MCA Circulars) and
Circulars No. 102/2021 dated 13th January, 2022 (MCA Circulars) and
Circulars No. 102/2021 dated 13th January, 2022 (MCA Circulars) and
Circulars No. 102/2021 dated 13th January, 2022 (MCA Circulars) and
Circulars No. 102/2021 dated 13th January, 2022 (MCA Circulars) and
Circulars No. 102/2021 dated 13th January, 2022 (MCA Circulars) and
Circulars No. 102/2021 dated 13th January, 2022 (MCA Circulars) and
Circulars No. 102/2021 dated 13th January, 2022 (MCA Circulars) and
Circulars No. 102/2021 (MCA Circulars) and
Circulars No. 102/ NOTICE OF 27TH ANNUAL GENERAL MEETING

To Arthur Alexan. In re-lements can attend also participate in the Askin through the Askin Alexan and SEBI directals, the Notice of AGM alongwith the Annual Report of the Company for the financial year ended on 31st March, 2021 Lab seben sent through enall on other September, 2021 to all members whose email addresses are registered with the Company) Depository Participant (DP). Registers and Transfer Agent (RTA), A copy of Notice Participant (DP). Registers and Transfer Agent (RTA), A copy of Notice www.martilinfra.in and website of the SEE Limited at www.beindia.com. The Notice of AGM is also available on the website of Central Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com. In compliance with the provision of Section 108 of the Companies Act 2011. The Company of the Company of the Company Section 2014 as amented from time to time and Regulations 4 of SEBI (Listing Chilghost Central Meetings issued by the Institute of Company Secretaries of India: and Disclosure Requirements Regulations, 2013 and Secretarial Standard General Meetings issued by the Institute of Company Secretaries of India: (a) The Company is providing remote e-voting facility as well as e-voting (a) The Company is providing remote e-voting facility as well as e-voting (a) The Company is providing remote e-voting facility as well as e-voting (a) The Company is providing remote e-voting facility as well as e-voting (a) The Company is providing remote e-voting facility as well as e-voting (a) The Company is providing remote e-voting facility as well as e-voting (a) The Company is providing remote e-voting facility as well as e-voting (a) The Company is providing remote e-voting facility as well as e-voting (a) The Company is providing remote e-voting facility as well as e-voting (a) The Company is providing remote e-voting facility as well as e-voting (b) The Company is providing remote e-voting facility as well as e-voting (b) The Company is the company in the company is the company in the company i

And Disclosure Requirements) Regulations: 2001 and Secretary Uniquenous and Conference and Restings issued by The Institute of Company Secretaries of India; 1) The Company is providing remote e-voting facility as well as e-voting facility during the AGM to its Members to cast their yets by electronic or India; 2012 at 09:000 and yet of the Conference of the Resolutions set durin the Resolutions set durin the Neutronic or 10 the Resolutions are during the Resolutions and yet of the Conference o

avanative during the AGM; Members holding shares as on the cut off date i.e. Thursday, 23rd September, 2021, shall only be entitled to avail the facility of remote e-voting or e-voting system at the 27th AGM;

e-voting or e-voting system at the 27th AGM;

If you have any queries or issues regarding attending AGM and e-Voting from the CDSL e-Voting System, you can write an email to helpdesk.evoting@cdslindia.com or contact at 022- 23058738 and 022-

عن 1 Alfez Solank 1 Alfez Solank 1 Alfez Sompliance Office

Kids Wear Brand Now in India

fibers.
Lilly & Sid is being presented in India by Norlanka Brands, the retail arm of the PDS Multinational Group that is responsible for launching the private label brands of the Group in India Middle. Group in India, Middle East and the South East Asian

Place: Ahmedabad Date: 04.09.2021

With a 100% organic cotton clothing line, Lilly+Sid's

Kids Wear Brand Now in India

Ahmedabad, From the shelves of heritage retailers sustainability without slike Harrods, Harvey Nichols and Selffidges, Lilly + Sid works only with SEDEX certified sourcing, Lilly + Sid works only with SEDEX certified factories and each of their products has received the prestigious Global Organic Textile Standard (GOTS) certification, the worldwide leading textile processing standard for organic presented in India by Norlanka Brands, the textile process of the PDS Multinational Group that is responsible for many years to come. many years to come.
Each collection
celebrates a colour
and is created to have.

celebrates a colour and is created to have. clean lines and simple repeat graphics that allows children to lead their lives in natural rhythm within the fabric of everyday life. (19-10)

GUJARAT NATURAL RESOURCES LIMITED Regd. Office: 3rd Floor, A Wing, Gopal Palace, Opp. Ocean Park, Nr. Nehru Nagar, Satellite Road, Ahmedabad - 380015
Phone No.: 079-40029806, E-mail ID: Info@gnrl.in Website: www.gnrl.in

members and Share Transper Dooks or the curriquery area.

2021 (Bibth days inclusive)

In Complained with MCA Crusted SEDI Circuist, the Notice of ACM along with the Annual Report for the financial

In Complained with MCA Crusted SEDI Circuist, the Notice of ACM along with the Annual Report for the financial

In Company or the Register and Share Transfer Agent or their respective Depository Participant

REMOTE E-VOTING:

REMOTE E-VOTING:

company or the Registrar and Share Transfer Agent or their respective Depository Participant(s).

REMOTE E-VOTING:

An and Share Transfer Agent or their respective Depository Participant(s).

REMOTE E-VOTING:

A state of the Registrar and Share Transfer Agent or their respective Depository Participant(s).

REMOTE E-VOTING:

A state of the Registrar and Share Transfer Agent or their respective Depository Participant(s).

Remogeneem and Administration) Amendment Rules, 2015 and Regulation, 2015. The Company is providing its member healtily to exercise their right to vote at the Annual General Meeting (AGH) by electronic means on all the businesses set off in the Notice of the AGM transfer businesses set off in the Notice of the AGM transfer businesses set off in the Notice of the AGM transfer businesses set off in the Notice of the AGM transfer businesses set off in the Notice of the AGM transfer businesses set of the Notice of AGM.

The set of the AGM transfer businesses of the Notice of AGM.

The set of the AGM transfer businesses of the Notice of AGM.

Period of e-voting: E-voting starts from 9:00 a.m. on 27th September, 2012 and ends at 5:00 p.m. on 29th September, 2012. These note that remote e-voting is 19th not be allowed beyond the above mentioned time and date. September, 2012, Please and that remote e-voting value of the Notice of AGM.

Notice of AGM is available on website of the Company (www.gnrl.in) as well as website of NSDL (www.compi.ndl.com), produced in the Register of Members or in the Register of Beneficial owners maintained by the depositories as on cut-off date ine, 3th, shall be entitle to available to not cut off date ine, 3th, shall be entitle to available to an out-off date only, shall be entitle to available to an out-off date only, shall be entitle to available to the Register of Members or in the Register of Beneficial owners maintained by the depositories as on cut-off date only, shall be entitle to avail the 6-cm.

(www.evinian.add.com). A evidential of the Company (www.gnrl.in) as well as website of NSDI A person whose ame is recorded in the Register of Members or in the Register of Beneficial owners maintained by the depositories as on cut-off date only, shall be entitle to avail the facility of remote eviding as well as voting a transport of the company (which is a company to the processor of the part of recasting votes.)

Members attending AGM through VC/QAWM facility, who have not casted their votes by remote eviding, the desired their votes through evoting at the AGM. Members who have casted their votes by termote eviding, may also attend the AGM through VC/QAWM facility. The procedure for e-voting, attending the AGM through VC/QAWM facility and registration of E-mail ID by shareholders has been provided in the Notice of AGM. The same is available on the website of the Company: www.gnrll.in, website of National Securities Depository Limited at www.evolong.edu.com. and at the website of and e-voting members/beneficial owners.

were united, website of the consequence bepassing failure at www.evoing.isol.com, and a tie website of the consequence of the c

For, Gujarat Natural Resources Limited By order of Board

SD/-Ashok C. Shah

Director DIN: 02467830

illy + Sid, Britain's Leading Organic Principal ends life, four educational department officials booked

Ahmedbad : On National Teachers' Day, a 44-year-old school principal allegedly committed suicide in the classroom of a primary school in Thordi village of Gir-Somnath district on Sunday, alleging mental harassment by local education department officials and teachers.
The principal Ghanshyam Amreliya was found hanging from the ceiling fan at around

Amreliya was round hanging from the ceiling fan at around 12:30pm. In a suicide note found on him, Amreliya blamed the Taluka Primary Education Officer and three others for mental torture, which led to him to take the dractic drow.

which led to him to take the drastic step.
One of the staff members spotted Amreliya hanging and informed police.
According to police sources, the higher officials named in the suicide note named in the suicide note were allegedy demanding Rs 25 lakh from him for not reporting his "liquor drinking" and saving his job and suspension.

The note recovered by police stated: "When I got transferred here from Anidiya village, higher officers

demanded Rs 25 lakh. Also, the Pay Centre school principal demanded Rs seven lakh and asked me to meet in person. I met him on the Jamwala school campus. He had told me that he had to give money to the district education officer. He told me not to talk over the phone regarding this issue."

The note further reads: "The principal told me that I

The note further reads:
"The principal told me that I attend school in a drunken condition and demanded money. I had given Rs 25 lakh cash to Jayesh Rathod and Goswami. Another teacher

from my school extorted Rs four lakh from me and threatened that if I asked for this money back, he would report that I was found drunk on duty. He even threatened on duty. He even threatened to kill me. So, I am ending my life today." "I am tired of the harassment from higher officers. I no longer want to live," the teacher reportedly wrote in the note.

wrote in the note.
Later, Amreliya's daughter
told reporters that her father
used to get phone calls after
which he used to get scared
and depressed. "He used to
remain aloof for the last

fortnight. He had mentioned about the blackmail by officials to the family too. He had also taken a loan from the bank and paid some amount. But I don't know the exact details of the amount," she said

said.

The girl said her father used to have a drink occasionally and the officials named in the suicide note named in the suicide note used to blackmail him saying that they would get him suspended and inform the higher education department officials that he came drunk to the school.

ASHNISHA INDUSTRIES LIMITED

CIN- L74110GJ2009PLC057629

Regd. Office: 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospital, Mithakhali Six Roads, Ahmedabad-380006.

Phone No.: 079-26463227.

E-mail ID: ashnishlamited@gmail.com

Website: www.ashnisha.in

Website: www.ashnisna.in NOTICE OF ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE DATES

E-VOTING INFORMATION AND BOOK CLOSURE DATES

ITICE is bereby given that the Annual General Meeting (AGN) of the members of the Company will be held

Wednesday, 29th September, 2021 at 3:33 p.m. IST through Video Conferencing ("VC") / Other Audic

ula Means ("OAM") to transact the businesses as set out in the notice of AGM in compliance with Genera

cular Nos. 14/2020 (dated 8th Agnil, 2020), 17/2020 (dated 13th Agnil, 2020), and 20/2020 (dated 5th May

2002), respectively, issued by the Ministry of Corporate Affairs ("MCA ("Crudings")) and Circular No. SEBI/ADI

("CMDI/CIRIP/2020/79 dated 12th May, 2020 issued by the Securities and Exchange Board of India ("SEBI

"India")

**DICMDI/CIRP/2020/79 dated 12th May, 2UU based by the securities on Carbon of Section 91 of the Companies Act, 2013 and as per provisions of Regulation 42 of the surities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, e register of members and Share Transfer books of the company shall remain closed from Friday, 24th sprember, 2011 to Wednesday, 29th September, 2021 (Both days inclusive). compliance with MCA Circulars and the SEBI Circular, the Notice of AGM along with the Annual Report for the annual year 2021-21 have been sent in electronic mode only to all those members whose e-mail Ids are egistered with the Company or the Registrar and Share Transfer Agent or their respective Depository withinsant(s).

financial year 2020-21 have been sent in electronic mode only to all those members whose e-mail Ids are registered with the Company or the Registera and Share Transfer Agent or their respective Depository Participant(s).

REMOTE 5-VOTING.

REMOTE 5-VOTING.

REMOTE 5-VOTING.

REMOTE 6-VOTING.

REMOTE 6-VOTING.

Remote 6-VOTING.

Remote 7-VOTING.

Remote 7-VOTING.

Remote 7-VOTING.

Remote 8-VOTING.

Remote 9-VOTING.

Remote

For, Ashnisha Industries Limiter By order of Board

SD/-Ashok Shah anaging Director DIN: 02467830

▲ zota* ZOTA HEALTH CARE LIMITED

NOTICE OF THE ANNUAL GENERAL MEETING (AGM) of the International Processing Services of Acts of the International Processing Services of Acts of the International Processing Services of Acts of International Processing Services of International Process

All shareholders of the company are informed that the Register of Members and the Share Transfer Books of the company will be closed from Friday, September 24, 2021 to Thursday, September 30, 2021 (both days inclusive) for the purpose of AGM and the final dividend for financial year 2020-21.

The CLO-off date for the purpose of final dividend is Thursday, September 23, 2021 (both days inclusive) for the purpose of AGM and the final dividend of the purpose of the AGM and the AGM and

the AGM. Members who have voted through remote e-voting shall be engine to discinsive the cut-off data gible to vice at the meeting, no have acquired the shares after sending the AGM Notice through electronic means and before the cut-off data for I and Password by sending a requiset at coscal@votabethare.com or evoting@msdl.co.in or may contact or per 1800-100-990 and 1800-224-400, as provided by NSDL. However, if a person is already registered with NSDL through the control of the control of the NSDL of AGM as well as sent to members by NSDL. Please refer to manual? for members available in download section of e-voting website at www.evoting.nsdl.com.

'e-voting user manual" for members available in download section of MANNER OF REGISTERING / UPDATING EMAIL ADDRESS

Members holding shares in physical form who have not yet registered / updated their email address are requested to registe same by writing to SAFILLITE CORPORATE ESERVICES PILT. ID, Registrar and Share Transfer Agent (PRIA*) along with nend copy of the request letter duly signed by the first shareholder, providing the email address, mobile number, self-attested by of PAN, Self-attested scanned copy of any document (Viz., Adarbar Card, Driving Liense, Passport) in support of the rises and Client Master copy (in case shares are held in electronic form) or copy of the share certificate (in case shares are held hybrical firm) to ensbe IRTA to register their e-mail address and to provide them the Notice and the e-voting instructions along

physical form) to enable k1 to project their E-main adultes and to province them are more, and use E-main is always and the first of the filter and the filt

For Zota Health Care Limited

Ashvin Variya Company Secretary & Compliance Officer

ASHOKA METCAST LIMITED

CIN - L70101GJ2009PLC057642

Regd. Office: 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospital, Mithakhali Six Roads, Mithakhali
Ahmedabad - 380006, Gujarat Phone No. : 079-26463226,

Ammedabad - 380006, Gujarat Phone No. : 079-2645226,
E-mail ID: Info@ashokametcast.in, Website: www.ashokametcast.in

NOTICE OF ANNUAL GENERAL MEETING,
E-WOTING INFORMATION AND BOOK CLOSURE DATES

NOTICE IS hereby given that the Annual General Meeting (ASH) of the members of the Company will be held on Thursday, 30th Day of September, 2021 at 3:30 p.m. through Video Conferencing (VCC) / Other Audio Visual Means (OAHY) of the members as set out in the notice of AGM in compliance with General Circular No. 14/2020 (dated 8h April, 2020), 12/2020 (dated 13th April, 2020) and 20/2020 (dated 8th Pay, 2020) respectively, issued by the Agricular Compliance with General Circular No. 14/2020 (dated 8h April, 2020), 12/2020 (dated 13th April, 2020) and 20/2020 (dated 8th Pay, 2020) respectively, issued by the Agricular and Exchange Board of India (CSBIL Circular).

Pursuant to Provision of Section 91 of the Companies Act, 2013 and as per provisions of Regulation 42 of the Securities and Exchange Board of India (CSBIL ORGAN), 2015, the register of members and Share Transfer books of the company shall remain closed from 27th September, 2021 to 30th September, 2021 to 30th September, 2021 to 2001 and 2002 (2011 have been sent in electronic mode only to all those members whose e-mail Ids are registered with the Company or the Register and Share Transfer Agent or their respective Depository Participant(s).

REMOTE E-VOTING:

impany or the Registrar and Share Transfer Agent or their respective Depository Participant(s).

MOTIC E-VOTITIES.

MOTIC E-VOTITIES.

MOTIC E-VOTITIES.

MOTIC E-VOTITIES.

MOTICATE THE MOTICATION OF THE MOTICA

and the of AGM is available on the Company (www.ashokametcast.in) as well as website of NSDL (www.evcling.ng.al.com.)

A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial owners maintained by the depositories as on cut-off date only, shall be entitle to avail the facility of remote evoting, as well as withing in the AGM. However, if the person is already registered with NSDL for remote evoting, then the existing Iser ID and AGM. However, if the person is already registered with NSDL for remote evoting, then the existing Iser ID and Password can be used for casting VoLMM facility, who have not casted their votes by remote evoting shall be Members attending AGM through V/COAVM facility, who have not casted their votes by remote evoting, may also attend the AGM through V/COAVM facility and registration of E-mail ID by shareholders has been provided in the Notice of AGM. The same is available on the website of the Company; www.ashokametcast.in, website of National Securities Depository Limited at www.evoting.nsdl.com. and at the website of ISE Limited; www.bseindla.com.

For Ashoka Metzast Limited:

For, Ashoka Metzast Limited:

For, Ashoka Metzast Limited:

For, Ashoka Metzast Limited:

For, Ashoka Metcast Limited By order of Board SD/-Ashok C. Shah Director DIN: 02467830

ગાંધીનગર મનપાની ૪૪ બેઠકો માટે ૩ ઓક્ટોબરે મતદાન : પમી તારીખે પરિણામ

ગાંધીનગર, ગાંધીનગર મહાનગર પાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પર મતદાન થશે. આ સિવાય ઓખા અને થરા નગર પાલિકાની પણ ચૂંટણી યોજાશે. જ્યારે અમદાવાદ મ્યુનિસિયલ કોર્પીરેશનની ૩ બેઠકો પર પણ ચૂંટણી યોજાશે. જ્યારે ૭ જિલ્લા પંચાયતની ૮ બેઠકો અને તાલુકા પંચાયતની ૨૦ યાજાત. જ્યાર છોલ્લા યચાયામાં ૨ જેક્કા એમ તાલુકા યચાયામાં ૨૦ બેઠકો પર પેટાચૂંટલી યોજાવા જઈ રહી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પર ચૂંટલી યોજાશે. આ સિવાય અમદાવાદ મહાનગર પાલિકાની ૩ બેઠકો, ૭ જિલ્લા પંચાયતો અને ૨૦ તાલુકા પંચાયતની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કોવિડ ગાઈડલાઈન્સના નિયમોના આધારે મતદાન કરવામાં આવશે.

દિશા રિસોર્સિસ લીમીટેડ

શ્સ્ટર્ડ ઓફીસ: ૩, રાજેશ એપાર્ટમેન્ટ, અજેતા કોમ. પાછળ, એસ્ટેટ ઓફ આશ્રમ રો અમદાયાદ-3૮૦૦૧૪. ફોન: (ઓફિ.) ૨૭૫૪૦૭૯૦, ૨૭૫૪૭૦૬૦ હેન્મેઇલ: info@aacl.co.in CIN:L74110GJ1995PLC024869 વેબસાઇટ∶ www.aacl.co.in

ર દમી વાર્ષિક સામાન્ય સભા ઇ-વોટિંગ અને બુક ક્લોઝર માહિતીની નોટીસ

- વાલુ વરા. રીમોટ ઇ-વોટીંગ બુધવાર,ર૯મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ સાંજે (પ.૦૦ વાગે) પુ Ш
- થશે. રીમોટ ઇ વોટીંગ અથવા એજીએમ પર વોટીંગ કરવાની યોગ્યતા નક્કી કરવા માટેની ક ઓક તારીખ : (૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૧) ૨૮૯મી સપ્ટેમ્બર ૨૦૨૧,ના રોજ સાંજે ૫.૦૦ વાગે પછી ઈ-વોટીંગ ઇલેક્ટ્રોનિક મોડ બં દગી રાત્રો
- કરી દેવાશે કંપનીની એક્કએમની નોટીસની વહેંચલી થઇ ગયા બાદ કોઇ વ્યક્તિએ શેર કટ ઓક ે એટલે (તા. રેંગ્સી સપ્ટેમ્બર) સુધીમાં પારલ કર્યા હશે તેઓ આઇડી અને પાસવર્ડ મેળવ માટે ઇ-મેપેલ helpicesk.evoltrg@cdslindia.com// ahmedabad@linkintime.co. પર વિનોની મોકલભાવી મેળવી શક્યે.
- પર વિનંતી મોકલવાથી મળવી શકાક સભ્યોને જ્ઞાક દરાવ્યાં આવે છે કે (એ) ગ્રીડીએસએલ પ્યારા ૨૯મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ સાંજે ૫.૦૦ વાગે રિમોટ ઈ વોટીંગ મોડાલું અધ્ય કરી દેવામાં આવશે મતી. આ દરા કહેવાર દરાય પર તોટ શઈ ગય પછી તેના કેટલા કરવાની મંત્રુંથી આપાવાંના આવશે મતી. (બી) એકએમના સાંજે લેહદે પર પારા તોટ આપાવાની પક્ષ ગ્રુલિયા આપવામાં આવે છે. લીજો કે કોઇ તેમને ઈન્ટોડિયના મામ્યમાં મહેલા વેટ આપી ડીધી હશે તો તે એકએમના લાજે ૨લી શકો પણ કરી તોટે આપી શકો મતી.
- હાજર દર્શા શક્યે પણ કરી વોટ આપી શકો નહીં. 10) જે વ્યક્તિનો નામ રજીસ્ટર ઓક મેમ્પર્સ અથવા રજીસ્ટર ઓક મેનિકિશિયલ ઓનર્સન્ટ ડિપોઝિટલી ક્રારા કર ઓકે ટેરમાં હતી કરતા તેમને પરિમોટ ઈન્સીટીંગ અને એક્ઝમેન્યા રજે એક્ટેડ પેપરની કુલિયા આપવામાં આવશે. એક્ઝમેન્યા નોટીક અનેમીની વેચ્લાઇટ www.aad.co.in તથા ચેન્ટ્રેલ ડિપોઝ્ટર સર્વિસ્ટલ (ડિપોઝીસ્ટ)

કંપની સેક્રેટરી એન્ડ કમ્પ્લાંયસ ઓફિસર (આઈસીએસઆઈ મેમ્બરશીપ નં. એ૪૮૨૫૮)

हिशा विभोर्भिभ बीभीटेर वनी



ECS

ઈસીએસ બિઝટેક લિમિટેડ CIN: L30007GJ2010PLC063070

રજિસ્ટર્ડ ઑફિસ: બી-૦૨, ધી કર્સ્ટ, ઈસીએસ કોર્યોરેટ હાઉસ, કેશવબાગ પાર્ટીપ્લોટની પાછળ, ઑક-૧૩૨ફ્ટ રિંગરોડ, વસાપુર, અમદાવાદ-૩૮૦૦૧પ સંપર્ક: secretarial@ecscorporation.com મોબા.: +૯૧ ૮૯૮૦૦૦૫૦૪૮

૧૧મી વાર્ષિક સાધારણ સભા, બુક ક્લોઝર તથા ઈ-વોટિંગની નોટિસ , નેસ બિઝટેક લિમિટેડની ૧૧મી વાર્ષિક

- એજીએમમાં બેલેટ પેયર દ્વારા મતદાન કરવાની સવલત ઉપલબ્ધ કરાવાશે. બેઠક પહેલાં જેમલે પોતાનો મત આપ્યો છે તેવા સભ્યો બેઠકમાં ભાગ લઈ શકશે, પણ ફરીથી મત આર્પ શકશે નહીં
- ાગ્રહ્માંતા આદનના મુખ્યાઓ મોદ અત્યાંના ૧૧ મા ગ્રાગ્યનાના માહ્યું, ગારા માહ્યું, ગારા માહ્યું, પાસ્તુકારા આદન એનોના કોઈ પ્રત્ય કે કિયાદ એને કિસ્ત સ્ત્રું દી કેલ્પર ફર્યો કેલ્પર પ્રત્યાના (FAQs) તથા www.vecting.com ઉપર હોલ્પ કેક ઉપર સેવાદ કે મોના ઈસીટિંગ યુડ્ડ મે ખુબલને તપાસનું, અથવા enoting@nsd.co.in ઉપર હોલ્પી જણાવવું, અથવા ઈસીએસ ભિઝટેક લિ.ના કંપની સેકેટરીને secretarial@escorporation.com ઉપર મેઇલ કરવો.
- ાની દ્વારા રિમોટ ઈવોટિંગ તથા બેલેટ પેપર પ્રક્રિયાને યોગ્ય અને પારદર્શક પદ્ધતિએ પાર પાડ ગૌતમ વીરસદિયાની નિમણુક પ્રેક્ટિસિંગ કંપની સેકેટરી (CP no: 19866)ને સ્કૂટિનાઇઝ

i આવી છે. i પરિણામો એજીએમ પૂર્ણ થયાના ૪૮ સક્રિય દિવસો દરમિયાન જાહેર કરાશે. સ્ફૂટિનાઇઝર-હેતનો આ પરિણામો કંપનીની વેબસાઇટ www.ecsbiztech.com ઉપર મકાશે.

biztech.com ઉપર મુકાશ. ઈસીએસ બિઝટેક લિમિટેડ વતી

ગુજરાતમાં કોરોના બાદ વાઈરલ ઈન્ફ્રેક્શનનું પ્રમાણ વધ્યું

સુરત, દર વર્ષે ચોમાસા દરમિયાન વાઈરલ ઇન્ફેક્શનના કેસ વધે છે. જે આ વર્ષે પણ દેખાઈ રહ્યાં છે. મારા ત્યાં ૧૦૦ દર્દીની ઓપીડીમાં વાઈરલ ઇન્ફેક્શનના ૭૦થી ૮૦ કેસ આવે છે. ભટાર, વેસુ, સિટીલાઈટ સહિતના વિસ્તારના દર્દી આવે છે. મોટાભાગના દર્દીને શ્રરદી, ખાંસી, તાવની ફરિયાદ હોય છે. જેરરી ટેસ્ટ તાવના રાત્યાર હાવ છે. કર્યા ટ્સ્ટ કરાતા ડેન્ગ્યુ, મેલેરિયા પણ ડિટેક્ટ થાય છે. પરિસ્થિતિ ગંભીર નથી. દર્દી ત્રણ–ચાર દિવસે સારા થઈ જાય છે. પરંતુ બીમારીને લઈ સાવચેતી જરૂરી છે. મારા ત્યાં આભાવા, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારમાંથી દર્દી યાપલાદ સાહાભા પ્રસાદનાયા દઠા આવી રહ્યાં છે. ૧૦૦માંથી ૪૦ કેસવાઈરલ ઇન્ફેક્શનના હોય છે. મોટાભાગના દર્દીઓમાં તાવ, માથું દુઃખવું, શરીર દુઃખવું, રાત્રીના તાવ વધી જવા સહિતના ફરિયાદો હોય છે. જોકે, યોગ્ય સારવાર બાદ ત્રણ ચાર દિવસે દર્દી માજો શઈ જાય છે ચાર દિવસ દદા સાજા થઇ જાવ છે. કોઈ દર્દીને દાખલ કરવાની નોબત આવી નથી. કોરોનાનો રિપોર્ટ કરાવીએ પણ તે નેગેટિવ આવે છે. સુરત સહિત ગુજરાતમાં ત્રીજી લહેરની દહેશત વચ્ચે કોરોના માંડ શાંત પડયો છે, ત્યારે રાજ્યભરમાં વાઈરલ ઇન્ફેક્શનના કેસોનું પ્રમાણ ખુબ વધી ગયું હોવાની બુમ ઉઠી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન વાઈરલ ઇન્ફ્રેક્શનના કેસો વધે છે, પરંતુ આ વખતે વાઈરલ ઇન્ફ્રેક્શનના કેસોમાં ખુબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિવારનો એક સભ્ય સંક્રમિત થયા

ખાનગી હોસ્પિટલોની સાથે કેમિલી કિઝીશીયન્સની ક્લિનીક પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજ્યભરમાં હાલ ઘરમાં એક સભ્ય રોગચાળાથી સંક્રમિત થાય, એટલે આખા પરિવારમાં ઇન્ફ્રેક્શનની કરિયાદ નોંધાઈ રહી છે. વાઈરલ ઇન્ફેક્શનની સાથે શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ગેસ્ટ્રો, ડાયરીયા, ટાઈફોઇડ જેવા કેસોમાં પણ ઉછાળો આવ્યો છે. શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવતા આરોગ્ય તંત્ર દ્વારા અન્ય રોગો સંબંધિત પ્રિવેન્શનની કામગીરી તરફ દુર્લક્ષ સેવાયું હોય તેમજ લાંબા સમય બાદ બજારો ખલવા સાથે લોકો છટછાટ હરતા તુલવા સાથ લાકા સુટઝાટ હરતા-કરતા થયા છે, અને બહાર ખાણી-પીણુનું પ્રમાણ પણ વધતા હાલ શહેરમાં વાઈરલ ઇન્ફેક્શનની સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનં પ્રમાણ વધ્યું હોવાનું તબીબોનો મત છે. શહેરમાં વાઈરલ ઇન્ફેક્શનની સાથે ડેન્ગ્યુ, મેલેરિયા, ગેસ્ટ્રો, ડાયરીયા, ટાઈફોઇડ જેવા કેસોનું પણ પ્રમાણ વધ્યું છે. સામાન્ય દિવસોની તુલનામાં મારા ક્લિનીક પર વાઈરલ ઇન્ફ્રેક્શનના કેસ ૫૦થી ૬૦ ટકા વધી ગયા છે. ખરાદી શેરી, ગલેમંડી મેઈન રોડ, સ્ટેશન વિસ્તાર સહિતના એરિયામાંથી કેસ આવી રહ્યાં છે. જોકે, આ દર્દીઓ યોગ્ય સારવાર બાદ ત્રણ-ચાર દિવસે સારા પણ થઈ જાય છે. પરંતુ સમયસર સારવાર લેવી હિતાવહ છે. આ વખતે પરિવારનો એક સભ્ય સંક્રમિત થયા બાદ એક પછી એક આખા પરિવારમાં ઇન્ફ્રેક્શન લાગી રહ્યું હોવાની ફરિયાદો વધુ છે. લોકો બહાર હરતા ઇન્ફે ક્શન લાગી રહ્યું હોવાની ફરિયાદો વધુ છે. લોકો બહાર હરતા-ફરિયાદ છે. શહેરની સરકારી અને ફરતા થયા હોય વોટર બોર્ન અને ફુડ

વૃદ્ધ સહાય માટે ઉમરના સર્ટીફિકેટ મેળવવા ભારે હાલાંકી ભોગવવી પડે છે

અમદાવાદ, પૂર્વ અમદાવાદમાં ઉમરના સર્ટીફિકેટ મેળવવામાં શહેરીજનોને ભારે હાલાંકી ભોગવવી પડી રહી હોવાની ફરિયાદો ઇકી છે. અર્બન હેલ્થ સેન્ટર, સ્થિવિલ હોસ્પિટલ, એલ. જી. હોસ્પિટલ, સાદદાબંહેન હોસ્પિટલ અને કહેલ્કર કેરીના પક્કા ખાવા લોકો મજણ તમ્યા છે. ત્રેક જી. જોએની ઘાક અરહ્ય કરીને 'બીજી જગ્યાએ તપાસ કરો, આ કામગીરી અહિંયા થતી ન હોવાના ' જવાબો ' બીજી જયાએ તપાસ કરા, આ કામગીરી ઓહેયા થતી ન હાવાના ' જવાળો સાંભળવા મળી કહો છે. નિરાયાર વૃદ્ધ તકાય, વિષ્ણેત સહાય, અપંગ સહાય તમજ પેત્શન યોજના માટે ઉમરના સર્ટી જરૂરી છે. જે લોકો પાસે આવાં સર્ટીફિકેટ નથી. તેઓએ મેડિકલ ઓકિસ્ટ પાસીથી આ સર્ટી મળવી પડ્યો હાય છે અને ત્યાર અને સિવિલ હોસ્પિટલમાંથી આ પ્રકારના સર્ટી મળી જતા હોય છે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી બંને જગ્યાએ ઉમરના સર્ટીફિકેટ કાઢી આપવામાં આવતા ન હોવાની ફરિયાદો વચ્ચે જરૂરીયાતવાળા શહેરીજનો આમત્યેમ ફાંકા મારી રહ્યાં છે. હવે શું કરવું તે વિશે સિનામાં પડી ગયા છે. આ અંગે મણિનગરમાં ગોરના કુલા કિસ્તાગમાં અગ્યાગ્યાલ એ ડાલિસમાં એના ગાલળ નાગળેન લીખાવ્યાસ્થ વિસ્તારમાં સત્યનારાયણ રો હાઉસમાં રહેતા રાવળ તારાબેન ભીખાભાઇ ાવસારના સાવવારાવા સં હાલસાય કરતા અંવે વાસ્ત્રાના ખાવાનાઓ જણાવ્યાં મુજબ એને સિવિલ સહિતની વિવિધ હોસ્પિટલોમાં છેલ્લાં ક માસથી ધક્કા ખાઇ રહ્યાં છે તેમ છતાંય તેઓને હજુ સુધી ઉંમરનું સરી મળું નથી. તેઓ પાસે રાશનકાર્ડ, ચૂંટલીકાર્ડ, આધારકાર્ડ હોવા છતાંય આ સર્ટીફિકેટ આદ્રોન આવતા ન હોવાની ફરિયાદ છે. અન્ય અરજદારીની પણ આ પ્રકારની ફરિયાદો ું અને કાર્યા એએ સિવિલ હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યાં મુજબ અરજદાર પાસે ચૂંટલીકાર્ડ, આધારકાર્ડ, રાશનકાર્ડ હોય તો ઉમરનું સર્ટી આપવામાં આવે છે. વૃદ્ધ સહાય માટે આ સર્ટી જરૂરી છે. તેમની ઉંમર નક્કી કરવા માટે પુરૂષના કિસ્સોમાં તેના બાળકોના એલ.સી.ના આધારે ઉમર અંગે અનુમાન લગાવાય છે, મહિલાના કિસ્સામાં તેને માસિક આવતું કથારે બંધ થયું તેના આધારે ઉમર નક્કી કરાતી હોય છે. બીજી તરક અરજદારો જણાવી રહ્યાં છે કે બધા પુરાવા હોવા છતાંયાં તેઓને ધરમધક્કા ખવડાવવામાં આવી રહ્યાં છે. પૂર્વ ઝોનના અર્ળન હેલ્થ સેન્ટરોમાં પણ ઉમરના દાખલા કાઢી આપતા ન હોવાનું અરજદારો

વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ : આરોપીની ધરપકડ

અમદાવાદ, સોશિયલ મિડીયા થકી થયેલો પરિચય યુવતી માટે મુસિબત બન્યો. ઈનસ્ટાગ્રામથી મિત્ર બનેલા યુવકે એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીને કેકી પીણું પીવડાવી અર્ધભેભાન કર્યા ભાદ અવારનવાર હુષ્કર્મ આચર્યું. ઉપરાંત ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધુમકી આપી હતી. યુવતીએ યુવકને રોકતા મારઝૂડ પણ કરી હોવાનું સામે આવ્યું છે. જેથી વેજલપુર પોલીસે બળાત્કા સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. વેજલપુર પોલીસની કસ્ટડીમાં ધરપકડ કરાયેલ આરોપીનું નામ જીત ત્રિવેદી છે. આરોપી એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે.

છ. પોલીસે જીતની ધરપકડ દષ્કર્મ યાલાત જીતમાં પરપંકે દુષ્કન, બ્લેક મેઇલિંગ અને મારામારીના ગુનામાં કરી છે. આરોપીએ એરહોસ્ટેસનો અભ્યાસ કરતી અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતીને પોતાના ઘરે મળવા બોલાવી હતી. બાદમાં પીઝા અને કોલ્ડ હતા. બાદમાં પાઝા અંપ કાલ્ડ ડ્રિક્સમાં કેફી પીણું પીવડાવી અવારનવાર દુષ્કર્મ ગુજારી યુવતીની મરજી વિના શારીરિક સંબંધો બાંધ્યા હતા. જે અંગે પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે જીત ત્રિવેદીની ધરપકડ કરી છે. યુવતીએ દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ સમક્ષ રજૂઆત કરી કે, આરોપીએ દુષ્કર્મ

ગુજાર્યા બાદ યુવતીને લગ્નની લાલચ આપી. બાદમાં આરોપીના માતા-પિતા યુવતીને મળવા માંગે છે. તેમ કહી એકલી ઘરે બોલાવી હતી. અને એકલતાનો લાભ લઈ ફરી વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે આ બનાવ બાદ પીડિતાને દુખાવો રહેતા માતા-પિતાને જાણ કરી હતી જેથી મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો. મહત્વનું છે કે સોશિયલ મીડિયાથી પરિચયમ આવેલી યુવતીએ યુવક પર આંધળો વિશ્વાસ રાખતા પસ્તાવાનો સમય આવ્યો છે. તો બીજી તરફ પોલીસે યુવકના મોબાઈલ અને સોશિયલ મીડિયાની તપાસ હાથ ધરી છે. જેથી યુવક પાસે યુવતીના કોઈ ફોટા છે કે કેમ, અને કોઈ જગ્યાએ વાયરલ કર્યા છે કે કેમ તેની તપાસ થઈ શકે. ત્યારે સમાન છે.

નામ બદલેલ છે : જુનુ નામ : નમ્ર નંદનકુમાર શાહ અથવા ઉર્ફે નમ્ર નંદનભાઈ શાહ, નવું નામ : **નમ્ર નંદન શાહ** રાખેલ છે. એડેસ : XO3 ઓમદર્શન એપાર્ટમેન્ટ ૭ . મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭, ગજરાત (ઈન્ડિયા) એફી.નં.૭૪૪૧, તા.૧૨-૮-૨૦૨

બોર્ન ડિસીઝનું પ્રમાણ વધ્યું છે. દર્દી ત્રણ ઉધના, પડિસરા, ભેરતાન, સચિન, ઇન, ચાર-દિવસમાં સારો થઈ જાય છે. દરરોજ લિંબાયત, ભટાર સહિતના ૧૫-૨૦ નવા કેસ આવે છે. મારા ત્યાં વિસ્તારમાંથી દર્દી આવી રહ્યાં છે.



મારૂતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ

૨૭ મી વાર્ષિક સામાન્ય સભા

આપી મોટિસ આપવામાં આવે છે કે દર્માના આખોની રાગી માં વર્ષિક સામાન્ય સભા ('સભા') આપી મોટિસ આપવામાં આવે છે કે દર્માના અભાને રાગી માર્ચિક સામાન્ય સભા ('સભા') વીડિયો કોન્ક રિનેસિંગ સમાવા અન્ય ઓડિયો રિન્યુસ્ત્રલ મોન્સ ('વીસી' ઓનેવોલોમ '') હાર સુરુપાર, ઉત્તર એપ્ટર, ૧૮૨૧ માં ઉપસ્થાન દેવાર પાત્ર હાંચે હોંગ્સ સંખ્યોન પેપિકના 'તે (૧૮૦૦ તાર્થિય દ એપ્ટિસ, ૧૦૦૦, પરિપત્ર મં. ૧૭/૧૦૦ તા. ૧૩ મી એપ્ટિસ, ૧૦૦૦, પરિપત્ર મં. ૧૭/૧૦૦ તા. ૧૩ મી એપ્ટિસ, ૧૦૦૦, પરિપત્ર મં. ૧૭/૧૦ તા. ૧૩ મી એપ્ટર, ૧૯૦૦, તાર્થિય કર્ય કર્યાં સ્થાને કરતા હોંચ્યાના તે દર ઉત્તર લોધો ૧૫ મોન્સ સ્થાને ૧૯૦૦ તા. ૧૩ મી એપ્ટર, ૧૯૦૦ તા. ૧

સરકાર મેં, જેટર બિસ્સીએ પેરિટો અને સેથી પરિવાર નો. SEB/HO/CEP(MD)/III/P/2005/FA તાદીખ ૧૨મે, ૨૦૧૦ અને પરિવાર નો SEB/HO/CEP(MD)/III/P/2005/FA પ્રી ભાજુમાં, 2૦૧૦ અને પરિવાર નો SEB/HO/CEP(MD)/III/P/2005/FA વિશેષ વ્યવસાયની લેવાડેના કરવા થયે. ૨૦૫૧ આપ્તા પોલસે, આ સભ્યો વીસી)ઓનેલીએમ દારા જ સવામાં હારિટી સાથે કેઇ અને ભાગ લેઇ શે. છે. આ સભ્યો વીસી) ઓનેલીએમ દારા એનસીએના પરિવારો અને સેલીના પરિવારો અનુસાર, ૩૧ માર્ચ, ૨૦૨૧ ના કોજ સમાપ્ત થયેલા નાશીલ વર્ષ માર્ચ કેવાના લાઉંક અલેવાલ સાથે જાંકબાનની નાશીલ ૦૦ મી. સાથે સ્ટેપ્સ, ૨૦૨૧ ના દોજ તમાપ સભ્યોને ઈમેઇલ હાર મોકલવામાં આવી છે, જેમના ઈમેઇલ સરનામાંઓ કંપની, પિક્ટિસી પાસિલિસ (PQ) (જિલ્ડેસ અને ફ્રાન્સસ એમ્જર (RTA) સંપોધ્યાલ) હોં સ્ટીપ્સ, પ્રો પ્રાથમિક પાસ્ત્રિયા માં કહ્યું પરિવારી છે. જ્યાપ્ત ક્રામાં સાથેલા છે. સ્ટેપ્સ, ૨૦૨૧ ના સાથેલા સાથેની નાર્ટિસની નાકલ કંપનીની વેખસાઇટ www.moutinfinain અને બીએસ્ટ્રી સાંચીની (GPA) (લિસ્ટ્રેસ (CDSL) ની વેબસાઇટ www.motinginda.com પર પણ ઉપલબ્ધ છે.

છે. કંપની અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૦૮, કંપનીઓ (મેનેજમેન્ટ અને એડીમેનિસ્ટ્રેશન) નિયમો ૨૦૧૪ ના નિયમ ૨૦ની સાંતે લોલાનો સોલી (સિટિઝ ઓવિસ્ટ્રેશન અને ટિસ્કોગ્રેટ રિક્સમાર્યન્ટ્સ) વેચ્રુલોલમાં, ૨૦૧૫ના નિયમ ૪૪ કોડાઅનેએન્ટિઝ્ટ્રુટ ઓક કંપની સેક્ટરીડ ઓફ ઇંપ્લિયા હાર જો ડી કરાયાં આવેલી સામાન્ય સમાઓની જોવાઈ અનુસારે (છ) કંપનીનીર અર્થો વાઉપ સામાન્ય સભાની નોટિસમાં નકી કરાયેલા દરાયો પર ઇલેક્ટ્રોનિક મુખ્યમાં માતાના કરવા થાટે તેમાં સમાનોને સમાદરિયાના પરિસાદ ઇન્સીટિઝ ફ્રોપિલા સ્ટાર

(a) કર્યાયા પાતા માં કરાતા માં ત્યાં માં માં માં માં માં કર્યાયા છે. માં માં માં માં માં માં માં તે તા સભ્યોને સભાદરમિયાન રિમોટ ઈ-વોર્ટિંગ સુવિધ ઈ-વોર્ટિંગ સુવિધા ઇપલબ્ધ કરી છે; (b) રિમોટ-વોર્ટિંગ સોમવાર, ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૧ સવારે ૦૯: ૦૦વાપ્યે શરૂ થશે;

. (c) રિમોટ ઈ-વોર્ટિંગ બુધવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ સાંજે ૦૫:૦૦ વાગ્યે સમાપ્ત થશે

સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે

) સંભયાના (વર્તના કેરવામાં ઓવા છું ક: () ભૂબાર, રૂપ સ્વર્થમ્યું, એક તેના કેર સાથે ઉપકલ વાગ્યા પછી રિમોટ ઈ-વોર્ટિંગ નિર્મિક્ક કરી દેવામાં આવશે; નિર્મિક્ક કરી દેવામાં આવશે; જું જે લાભ્યો લીત્રો અવવા એમેનીએમ દ્વારા સભ્યામાં હાજરી આપણે અને રિમોટ ઇ-વોર્ટિંગ દ્વાર કરાવો પર પતાનો મત ન આપ્યો હોય તેઓ સભા દરમિયાન તેમના મતદાન અધિકારોને ઉપયોગ કરી કાશે, ઈ-વોર્ટિંગ મોટેની સુવિધા સભા દરમિયાન ઈ-વોર્ટિંગ સિસ્ટમ દ્વાર ઇપલભ્ય કરાવવામાં આવશે;

(ઇલલ્લમ-દેશવસમાં આવશે; ત્રો જે લખ્યો પહેલી જ રિમોટ ઇ-વોર્ટિંગ હારા પોતાનો મત આપી ચૂચ્યા છે તેઓ વીંતી સ્વાર ઓન્વેનીએન હાર તેકામાં ભાગ લઈ શકે છે પરંતુ લમાદારીયના 'ઇલલ્લમ ઈ-વોર્ટિંગ સિસ્ટમ હારા દરિવી ધોતાની મત આપવા માટે હકાર રહેશે નહીં, (ઇ/ફ્રાટ ઓક લાર્ટીંગ અંદે કે કુંગ્રુવાર, ટક્ક્રેપેલર, ૨૦૨૧ ના ચેજ શેર ધરાવતા સભ્યો જ માત્ર ૨૦ પી સભા માં રિમોટ ઈ-વોર્ટિંગ અથવા ઈ-વોર્ટિંગ સિસ્ટમની સુવિધા યેળવવા માટે હકાર રેસેશે;

હક્કાર રહેશે; જ્વે તમને સીડીએસએલ ઇ-વોર્ટિંગ સિસ્ટમથી એજીએમ અને ઇ-વોર્ટિંગમાં હાજરી આપવા અંગે કોદ શ્રુપ્ત એથવા સમસ્યાઓ હોય, તો તમે helpdesk.evoting@cdslindia.com પર ઈમેઇલ લખે શકો છો અથવા ૦૨૨ -૨૦૫૮૭૩૮ અને ૦૨૨ -૨૩૦૫૮૫૪૨ /૪૩ પર સંપર્ક કરી શકો. છો. હતા of measures—૧૫૩ જેના દારન કરતા હતા. હિલ્ફ્રોનિક માધ્યમથી માતદાન માટેની શ્રીવિધા સાથે જોડાયેલી તમામ શરિયાદી શ્રી દોકોક દલવી સીનીયર મેને મંત્રમ, (DEA,) સુત્ર દિપાકીઝાટી સર્વિકાર્સ (ઇન્ટિયાદી ક્ષિક્રિકેટ, એ સિંગ, રામ માના, મેરેશોન શરૂલર, મહતલાલ મિલ કપ્પારેગ્ર, એને નામ, સેલી માનું, લોખર પરેલ (પૂર્વ) મુંલઈ - ૧૦૦૦/13 અથવા helpdesk.evoting@cdinida.com પર ઉમેર્લક મોક્સ સ્થાલ ૦૨૨-૨૩૦પ્ટપ.૧૪(૪) પર હોલ કોર્ડ

અલ્ફેઝ સોલંકી કંપની સેક્રેટરી અને કંમ્પલાયંસ ઓફિસર

Relicate

રેલીકેબ કેબલ મેન્યુફેક્ચરીંગ લીમીટેડ

ો પણ (૧-નો), બેલ્લાલેક ઇન્કર્સિકાલ એક્ટેક્ટ, ફનેશ, દામા-કાર્ટ્સલ (૧.4) પોતાના કોઇ કાંદ્રવા હતા. કોઇ કાંદ્રવા કલ્યા કલ્યા કોઇ કાંદ્રવા કલ્યા કલ્યા કોઇ કાંદ્રવા કલ્યા કલ્યા

ઉપયોગ કરી શકે છે

Grider:
(એ) વિમોર ઇમ્પર્કોમાં બુલાવાર, રજ સપ્ટેમ્બર ,રજ્યા ના સંજ સાંજ પાડળ વારા કરે.
(એ) વિમોર ઇમ્પર્કોમાં બુલાવાર, રજ સપ્ટેમબર ,રજ્યા ના સંજ સાંજ પાડળ વારા કરે.
(એ) બંદીર સપ્ટેમ મનદાવાની સવલત પાત્ર સેમોર ઇમ્પ્ર-નોર્દિગ દ્વારા તેમાના લાગ કરે.
(એ) બંદીર સપ્ટેમ મનદાવાની સવલત પાત્ર સેમોર ઇમ્પ્ર-નોર્દિગ દ્વારા તેમાના કર્યો હોય કરે.
(એ) બંદીર કોમ્પર ઇમ્પ્ર-ને સાંજ સંજ પાત્ર સેમાના કર્યા કરે.
(એ) સ્વાર કોમ્પર ઇમ્પ્ર-ને સાંજ સંજ સંજ સ્વાર કરે.
(એ) સ્વાર કોમ્પર ઇમ્પ્ર-ને સાંજ સંજ સાંજ સંજ સંજ સ્વાર કરે.
(એ) સ્વાર કોમ્પર કર્યા કે હામ કાર્ય સ્વાર કરે.
(એ) સ્વાર કોમ્પર કર્યા કે હામ કાર્ય સ્વાર કર્યા કરે.
(એ) સ્વાર કોમ્પર કર્યા કરે હામ કરે સાંજ સંજ સંજ સંજ સંજ સંજ સંજ સ્વાર કરાય કરે.
(એ) સ્વાર કાર્ય સ્વાર કાર્ય કરે હામ કરે હામ કરાય કરે હામ કરે હામ

— નામ બદલેલ છેઃ જુનુનામઃ પરીતાબેન નંદનકુમાર શાહ અથવા ઉર્ફે પરીતાબેન નંદનભાઈ શાહ, નવું નામ : **પરીતા નંદન શાહ** રાખેલ છે. એડ્રેસ : ૪૦૩, ઓમદર્શન મહાવીઃ સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭, ગુજરાત (ઈન્ડિયા) એફી.નં.૭૪૪૨, તા.૧૨-૮-૨૦૨૧

નંદનકમાર કાન્તિલાલ શાહ અથવા ... 3ર્ફે નંદનભાઈ કાન્તિભાઈ શાહ, નવું નામ : **નંદન કાન્તિલાલ શા**હ રાખેલ છે. એડેસ : ૪૦૩, ઓમદર્શન એપાર્ટમેન્ટ. મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭, ગુજરાત (ઈન્ડિયા) એફી.નં.૭૪૪૦, તા.૧૨-૮-૨૦

એરોમા એન્ટરપ્રાઇસેસ (ઇન્ડીયા) લીમીટેડ

૨જી. ઓફીસ : ૮૮, અજંતા કોમર્શિયલ સેન્ટર, ઇનકમટેથ સર્કલ પાસે અક્ષમ રેડ, અપ્તકાયાયન સંપ્રદુષ્ટ ભાગવાયન અક્ષમ રેડ, અમકાયાક - ૩૮૦૦૦૯ ઈ-મેઇલ : compliance.mgc@gmail.com, વેબસાઇટ: www.aromaenterprises.in કોન નં. +91-79-27540175 CIN: L51909GJ1994PLC021482

૨૭મી વાર્ષિક સામાન્ય સભા, ઈ-વોટિંગ તથા બુક-ક્લોઝર અંગેની નોટિસ

અજીત્યનપા કરાય. D. સ્થિટ ઈનોટિટિની શરૂઆત તા. રાખી સંખેબર, ૨૦૨૧ને સોમવારના રોજ સવારે ૧૦.૦૦ વાર્ગ્ય શો, તથા તે તા. રાખી સંખેબર, ૨૦૨૧ના રોજ સોજ ૫૦૦ વાર્ગ્ય પૂર્ણ શો. C. સ્થિટ ઈનોટિટિને એજીએમ પાર્ત ઇનોટિને સિસ્પ્ય હારા ખાતા મહીનો યોગ્યાના નાક્કી કરવાની છેલ્લી તાર્ટીખ ૨૪મી સંખેબર, ૨૦૨૧ નિમિત કાર્ય છે. G. સ્થિટ ઈનોટિટિને મોહાલુંના ... રર્લ્લી સંખેબર, ૨૦૨૧ના રોજ સોજ ૫.૦૦ વાર્ગ્ય બેય કટી

યાત વાળાથી માહિતાના રીમ્ટિક્ટરમાં મીંચમાં હોય તેમાં એક્ક્રએમ માહે વિમોર વીટિંગની સ્વાહતમાં લાખ માલે.

9. ક્રીમેટલાઈડ્ડ સ્વર્યું, હિલ્લેલ્ડ ત્વારું કેલ પ્રદાવતા સમ્યો તામાં લેખાને બેંધિલા રીસ્ટિક્ટ કરાયો નાંધી લાખ તેમાં માટે વિમોર વીટિંગની સ્વાલાહં કરે. કમ્યાંની વેલાનાં પાર્ટ વિમોર વિદેશ કરાયો નાંધી વિમારનો પાર્ટી કર્યા કર્યા હોંદા કર્યા હોંદા કર્યા કર્યા હોંદા કર્યા હોંદા કર્યા કર્યા હિંદાનાં પાર્ટી કર્યા કર્યા હોંદા હોંદા કર્યા હોંદા કર્યા હોંદા કર્યા હોંદા કર્યા હોંદા કર્યા હોંદા હોંદ

મેનેજીંગ ડાયરેકટર ડીન નં. ૦૩૦૯૭૩૨૧

ઇન્ટરેક્ટીવ ફાઈનાન્સીયલ સર્વિસીસ લીમીટેડ

રજી. ઓફીસ: એ -૧૦૦૬ ,પ્રીમીયમ હાઉસ, હેન્ડલુમ હાઉસ પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ ઈ-મેઇલ : info@ifinservices.com, લેપસાઇટ: www.ifinservices.com હોમ તં. +91-79-26581240 CIN: L65910GJ1994PLC023393

૨૭મી વાર્ષિક સામાન્યસભા, ઈ-વોટિંગ અને બુક-ક્લોઝરની નોટિસ

તેવી.

Full દેવી કર્યાં કર્યાં કર્યાં આપતાં આપતાં સભ્યો પહેલાં કે સભ્યો મહેલા કિલ્લ્યુંથી આક્કા ક્લેચલા (ANC) મહેલા સામાં આપતાં સભ્યો સંભ્યો કેશનાના સંસ્થાના સંસાના સંસ્થાના સંસ્થાના

ઇન્ટરેક્ટીવ ફાઈનાન્સીયલ સર્વીસીસ લીમીટેડ, વતી

સહી/ શ્રી ઉદયન માંડવીયા મેનેજીંગ ડાયરેક્ટર ડીન નં.૦૦૭૪૦૬૧૫

સહી-વિજય મંડોરા (મેનેજિંગ ડિરેક્ટર) DIN: 00328792